



JAI SHREE RAM

TEMPLE SHREE RAMJI MANDHATA

INCORPORATED 1992

CHARITÉ CANADIENNE ENREGISTRÉE / REGISTERED CANADIAN CHARITY

8155, RUE DUROCHER, MONTREAL, QUEBEC H3N 2A8

TEL.: (514) 277-9298



રવિવાર તા. ૧૬મી સપ્ટેમ્બર, ૨૦૧૯

આદરણીય વડીલો, ભાઈઓ અને બહેનો

નમસ્કાર,

આશા છે આપ સૌ પરિવાર સહિત કુશળ હશો. સંસ્થા વતી આ વર્ષની છેલ્લી પત્રિકા મોકલાવતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. આ વર્ષે સમર સિઝન દરમ્યાન દરેક મોટા પ્રસંગો જેવા કે શ્રી સાંઈ મહોત્સવ, શ્રી જન્માષ્ટમી, શ્રી ગણેશ મહોત્સવ વિગેરેનું સફળતાપૂર્વક આયોજન કરી શક્યા તે બદલ યજમાન પરિવારો સહિત આપસૌને પણ ધન્યવાદ પાઠવીએ છીએ. આ વર્ષે આપણા મંદિરમાં મોટી સંખ્યામાં માંગલિક પ્રસંગો પણ સંપન્ન થયાં. સંસ્થા વતી સર્વને આશીર્વાદ પાઠવતાં આનંદની લાગણી અનુભવીએ છીએ અને દરેક વાલીઓને ધન્યવાદ પાઠવીએ છીએ. આ સાથે વર્ષનાં અંત સુધી આપણી સંસ્થામાં આયોજિત થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોથી આપ સર્વેને માહિતગાર કરી રહ્યાં છીએ જેમાં આપ સર્વેને પરિવાર સહિત ભાગ લેવાનું હાર્દિક નિમંત્રણ છે.

- **શ્રદ્ધાંજલિ:** આ વર્ષ દરમ્યાન દિવંગત થયેલા આપણા પરીજનોના સ્મરણાર્થે સંસ્થા વતી શ્રદ્ધાંજલિ સ્વરૂપે આયોજિત સત્સંગ શનિવારે ૨૧મી સપ્ટેમ્બર સાંજે ૬:૦૦ કલાકે આયોજિત થાશે. સંસ્થા વતી દરેક શોકાતૂર પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના અને સહાનુભૂતિ વ્યક્ત કરીએ છીએ.
- **પિતૃ-તર્પણ:** ૨૮મી સપ્ટેમ્બર, શનિવારે સાંજે ૭:૩૦ કલાકે સંપન્ન થાશે. આ તર્પણ વિધીમાં ભાગ લેવા માટે આપણા પુર્વજોને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પૂજા સંપન્ન કરવા માટે માત્ર \$૫૧નું અનુદાન રાખવામાં આવેલ છે. આ પૂજામાં ભાગ લેવા માટે મંદિરના પુજારી મહારાજોનો સંપર્ક સાધવા વિનંતી ફોન: 514-277-9298
- **નવરાત્રિ મહોત્સવ:** આપણી ગુજરાતી પરંપરાના સૌથી મોટા ત્યોહારનું આયોજન પારંપરિક વિધિથી તા. ૨૯મી સપ્ટેમ્બરથી ૭મી ઓક્ટોબર દરમ્યાન આયોજિત કરવામાં આવશે. છેલ્લી ઘડીએ લવાલ વિસ્તારમાં રહેતા આપણાં પરિવારજનો મુખ્ય યજમાનપદની જવાબદારી ઉપાડી લઈ સંસ્થાને ખરેખર સહાયરૂપ બન્યા છે. આ વર્ષે નવરાત્રી મહોત્સવ દરમ્યાન આવતા બે શનિવારે હોલમાં ગરબાનું આયોજન પણ લવાલ વિસ્તારમાં જ રાખવામાં આવ્યું છે જેની વિગતવાર માહિતિ આ પત્રિકા સાથે જ સંલગ્ન કરી રહ્યા છીએ. સંસ્થા દ્વારા આવા મોટા અને ભવ્ય આયોજન દ્વારા આપણાં સમાજને પરંપરાગત સાંસ્કૃતિક મનોરંજન પુરું પાડવાના પ્રયાસમાં આપ સૌ સહભાગી બની ને પોતાનું યોગદાન અને સહકાર આપશો એવી આશા સહિત વિનંતી સાથે આપ સૌને આ આયોજના મોટી સંખ્યામાં સહપરિવાર ભાગ લેવાનું આમંત્રણ પાઠવીએ છીએ. ગરબાની ટિકિટો સાથે આપ સૌ Lucky Draw ની ટિકિટો મેળવીને પુરસ્કાર પણ જીતી શકો છે. જે વિષેની માહિતી ફ્લાયરમાં આપવામાં આવી છે.

માટલી પૂજન અને સ્થાપન: રવિવાર, તા. ૨૯મી સપ્ટેમ્બરના રોજ સાંજે ૫:૦૦ કલાકે

નવરાત્રી દરમ્યાન નવ દિવસ ગરબાનો કાર્યક્રમ સાંજે ૭:૦૦ થી ૯:૦૦ વાગ્યા સુધીનો રહેશે.

ચંડીપાઠ: નવરાત્રિ દરમ્યાન ચંડીપાઠ રવિવાર, તા. ૬મી ઓક્ટોબરના રોજ સાંજે ૩:૦૦ કલાકે સંપન્ન થાશે.

- શ્રી લક્ષ્મી પૂજન અને દિવાળી પર્વની ઉજવણી: તા. ૨૫મી ઓક્ટોબર અને શુક્રવારે સાંજે ૫:૦૦ કલાકે. શ્રી લક્ષ્મી પૂજનના મુખ્ય યજમાન માટે \$૨૫૧ અને સહ યજમાન માટે \$૫૧ નું અનુદાન રાખવામાં આવ્યું છે. પૂજામાં ભાગ લેવા માટે મંદિરનાં પૂજારી શ્રીનો સંપર્ક સાધવા વિનંતી.
- શ્રી અન્નકૂટ ઉત્સવ અને હિંદુ નૂતન વર્ષની ઉજવણી: ૨૮મી ઓક્ટોબર અને સોમવારે સાંજે ૬:૦૦ કલાકે
- દિવાળી સાંસ્કૃતિક કાર્યક્રમ: ૨જી નવેમ્બર અને શનિવારે સાંજે ૩:૦૦ કલાકે.

સ્થળ: Lavoie High School, 6755 Rue Lavoie Montreal QV H3W 2K8.

આપ સૌને સહયોગ અને પ્રોત્સાહન આપી આ પ્રસંગને સફળ બનાવવામાં મદદરૂપ થવાની નમ્ર વિનંતી છે.

વધુ માહિતી માટે તથા કાર્યક્રમમાં ભાગ લેવા માટે સંસ્થાની મનોરંજન સમિતિના શ્રી કિશોરભાઈ આર. 514-823-3813, શ્રી જયેશભાઈ ડી. 514-299-1570, રમેશભાઈ સી. 514-299-1096 અથવા જગદિશભાઈ એન. 514-827-3930 નો સંપર્ક સાધવા વિનંતી

- શ્રી જલારામ જયંતીની ઉજવણી: સદભાગ્યે આ વર્ષે પુ. બાપાનો જન્મદિવસ ૩જી નવેમ્બર અને રવિવારે છે તેથી એજ દિવસે સવારે ૧૦:૦૦ કલાકે, નવરંગ ગ્રુપનાં ભજનકીર્તન સાથે ઉજવવામાં આવશે.
મુખ્ય યજમાન: શ્રી મહેશભાઈ દયાળભાઈ મછાડ, અને શ્રીમતી મીનાબેન હસુભાઈ મટવાડ અને પરિવારજનો.
- શ્રી તુલસી વિવાહ: ૧૨મી નવેમ્બર, મંગળવારે સાંજે ૬:૩૦ કલાકે.
યજમાન: શ્રીમતી સુધાબેન ભુપેદ્રભાઈ, શ્રીમતી ચંચળબેન નરેશભાઈ, શ્રીમતી દિપ્તીબેન હસમુખભાઈ અને શ્રીમતી રમાબેન કાનજીભાઈ
- અંગ્રેજી નૂતન વર્ષ: વર્ષ ૨૦૨૦ના સ્વાગત અંગે ૧લી જાન્યુઆરી, બુધવારના રોજ સવારે ૯:૦૦ કલાકે ૫૧ હનુમાન ચાલીસાના પારાયણનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગનાં યજમાન બનવાની ઈચ્છા હોય તેમને સત્સંગ સમિતિનાં ચેરમેન શ્રી અરવિંદભાઈ બી. ૫૧૪-૬૮૮-૯૧૪૨ અથવા તો મંદિરનાં પુજારીશ્રીનો ૫૧૪-૨૭૭-૯૨૯૮ પર સંપર્ક સાધવા વિનંતી

ટૂંક સમયમાં આપણા સીનીયર્સ, મુરબ્બીજનો ૪ થી ૫ માસ માટે ભારત પ્રવાસ માટે રવાના થાશે. સર્વેને સુખદ પ્રવાસ અને દેશમાં રોકાણ દરમ્યાન સ્વસ્થ સ્વાસ્થ્યની શુભેચ્છા પાઠવીએ છીએ. સંસ્થાની કાર્યવાહક સમિતિનાં નવયુવાન સભ્યો સોશીયલ મિડિયાનાં પ્લેટફોર્મ પર ખુબજ સક્રિય રહી વિવિધ પ્રવૃત્તિઓથી આપ સૌને માહિતગાર કરી રહ્યા છે. તેમને સહયોગ અને પ્રોત્સાહન આપવાની નમ્ર અપીલ.

અંતમાં આપ સૌના સહયોગ બદલ ખુબ ખુબ આભાર અને આપ સૌને નવરાત્રિ અને આવનારા નૂતનવર્ષની હાર્દિક શુભેચ્છાઓ.

કાર્યવાહક સમિતિ વતી

પ્રમુખ શ્રી

ઈશ્વરલાલ આર, પટેલ



514-389-0181 /lshwar.nila@gmail.com

મંત્રી શ્રી

યોગેશ સી. પટેલ



514-815-9701/ypatel@skylawn.net